GAUTAM GEMS LIMITED

(CIN: L36911GJ2014PLC078802)

REGISTERED OFFICE: 3RD FLOOR, OFFICE-301, SUMUKH SUPER COMPUND, VASTA DEVADI ROAD, SURAT- 395004.

EMAIL: COMPLIANCEGGL@GMAIL.COM PH: 912612538046 M: 9376495444

WEBSITE: WWW.GAUTAMGEMS.COM

Date: 31.05.2024

To
The General Manager-Listing
Corporate Relationship Department
The BSE Limited
Phiroz Jeejeebhoy Tower
Dalal Street, Mumbai-400001
Scrip Code: 540936

Sub: Submission of Newspaper advertisement copies of the extract of audited Financial Results of the Company for the Quarter and year ended 31st March, 2024

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of financial results of the Company for the quarter and year ended 31st March, 2024 published in the following newspapers dated on 31st May, 2024:

- 1. Business Standard (English)
- 2. Jai Hind (Gujarati)

Kindly take the information on record and oblige.

Thanking you,

Yours faithfully,

FOR GAUTAM GEMS LIMITED

Gautam

Pravinchandra

Pravinchandra

Sheth

Gautam

Pravinchandra

Gautam

Pravinchandra

Gautam

Gautam

Pravinchandra

Gautam

Gaut

GAUTAM PRAVINCHANDRA SHETH MANAGING DIRECTOR

DIN: 06748854

ARIHANT FOUNDATIONS & HOUSING LTD. Regd. Off: No.3,Ganapathy Colony, 3rd Street, Teynampet, Chennai - 600 018. CIN:L70101TN1992PLC022299 | Email: investors@arihants.co.in | Website: www.arihantspaces.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31* MARCH, 2024

									(< III lakiis)		
		Standalone				Consolidated					
S.	Particulars	Quarter Ended		Year Ended		Quarter Ended			Year Ended		
No.			31.12.2023				31.03.2024			31.03.2024	31.03.2022
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations	3,398	2,276	2,425	9,017	5,858	4743	3573	2167	13573	8459
2	Net Profit / (Loss) for the period (before tax,										
	Exceptional and / or Extraordinary items)	239	83	12	433	162	379	1098	195	2038	1283
3	Net Profit / (Loss) for the period before tax										
	(after Exceptional and / or Extraordinary items)	239	83	12	433	162	379	1098	195	2038	1283
4	Net Profit / (Loss) for the period after tax										
	(after Exceptional and / or Extraordinary items)	183	60	9	323	116	90	907	86	1351	997
5	Total Comprehensive income for the period										
	(Comprising Profit/ (Loss) for the period (after Tax)										
	and Other Comprehensive Income (after Tax)]	180	60	10	321	117	88	907	92	1349	1004
6	Paid-up Equity Share Capital	860	860	860	860	860	860	860	860	860	860
7	Reserves (excluding Revaluation Reserves As										
	shown in the Balance Sheet of previous year)				17,136	16,816				19,149	17,791
8	Earnings Per Share (in ₹)										
	1. Basic (₹).	2.13	0.70	0.10	3.76	1.34	1.04	10.55	1.00	15.70	11.60
	2. Diluted (₹).	2.13	0.70	0.10	3.76	1.34	1.04	10.55	1.00	15.70	11.60
Made	10.		•								

1. The above is an extract of the detailed format of Audited Standalone and consolidated financial results for the quarter and year ended 31.03.2024 filed with the Stock exchanges under Regulation 33 of the SEBI Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited financial results for Quarter and Year ended 31.03.2024 is available on the Stock Exchange websites at www.bseindia.com and also on the Company's website at www.arihantspaces.com.

2. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their meeting held on 30.05.2024

4. As required by under Regulation 33 of the SEBI (Listing Obligations and Disciosure Requirements) Regulations, 2015, the review by the statutory auditors has been completed for the Quarter and year ended 31.03.2024 and the report has been forwarded to the stock exchange. The Report does not contain any qualification.

5. Previous period's figures have been regrouped/reclassified whereever required.

BY ORDER OF THE BOARD FOR ARIHANT FOUNDATIONS & HOUSING LIMITED KAMAL LUNAWATH MANAGING DIRECTOR DIN:00087324

Place: Chennai Date: 30.05.2024

Place : Ahmedabad

Place: Thane

Date: May 30, 2024

बैक ऑफ़ इंडिया Bank of India Relationship beyond banking

ASSET RECOVERY DEPARTMENT 6th Floor, Bank Of India Building, Bhadra, Ahmedabad, Phone: 079-66122528, 66122530 POSSESSION NOTICE RULE-8(1 (For Immovable Properties)

The undersigned being the Authorized Officer of the Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notices on the under note dates in respect of various loan / Financial Assistance under its credit facilities, calling upon the respective borrowers / guarantors to repay the amount mentioned in the notices being further interest thereon within 60 days from the date of receipt of the said notices. The respective borrowers/guarantors having failed to repay the amount, notice is hereb given to the borrowers/guarantors and the public in general that the undersigned has taken Possession of the properties described herein below an each account in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules and on this below mentioned date. The respective borrowers/ guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealing with the properties will subject to charge of Bank of India, Ahmedabar for the amounts and with further interest thereon till the date of payment and incidental expenses, costs, charges thereon mentioned against each accounts herein below. The

Borrowers & Guarantors Date / Outstanding Amount (Rs.)	respe	ective borrower's attention is invited	to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured a					
(Proprietorship Firm Proprietor- Mr Rajesh K Gopani), Mr. Rajesh K. Gopani), Mr. Rajesh K. Gopani), Mr. Rajesh K. Gopani), Mr. Rajesh K. Gopani, Mr. Rajesh K. Gopani, Mr. Rajesh K. Gopani, Mr. Rajesh K. Gopani, Mr. Rajesh K. Gopani and Guarantor - Mr. Kamleshbhai Kishorbhai Gopani Branch: Income Tax Char Rasta Two Paise Only		Borrowers & Guarantors	Date / Outstanding	Description of Immovable Properties	Date / Type of Possession				
Guarantors - M/s SLS Industries Pvt. Ltd., Shri Shantilal P Sanghavi, Smt. Manijula S Sanghavi, Mys. Optima Stainless Pvt. Ltd. Branch: Ahmedabad Recovery Branch Forty Two Paise Only) Possess Pvt. Ltd. Branch: Ahmedabad Recovery Branch Strict Ahmedabad Recovery Branch Strict Ahmedabad Rejective Strict Ahmedabad - (Naroda), bounded as: On or towards Sast by: Flat No. D/5, or towards Sast by: Flat No. D/5, or towards South by: Stair Case. Possess Pvt. Ltd. Strict Ahmedabad - (Naroda), bounded as: On or towards Sast by: Flat No. D/5, or towards South by: Stair Case. Possess Pvt. Ltd. Strict Ahmedabad - (Naroda), bounded as: On or towards Sast by: Flat No. D/5, or towards Sast by: Flat No. D/5, or towards North by: Open to Sky Space, or towards South by: Stair Case. Possess Pvt. Ltd. Possess Pvt. Ltd. Possess Pvt. Ltd. Pvt. Pvt. Pvt. Pvt. Pvt. Pvt. Pvt. Pvt.	1	(Proprietorship Firm Proprietor - Mr Rajesh K Gopani), Mr. Rajesh K. Gopani and Guarantor - Mr. Kamleshbhai Kishorbhai Gopani	Rs. 19,79,926.02/- (Rs. Ninteen Lakh Seventy Nine Thousand Nine Hundred Twenty Six and	industrial godown no 140 at ground floor admeasuring 481.03 sq.ft (super Built up area) (Municipal Tenement No 0638-95-6501-0128-L) in "Sarkhej Co. Op Housing Society Ltd." (registration no GH-1053 dated 06.06.1993) the Scheme famously known as "Sahajanand Estate" constructed on Non Agricultural land bearing Block/Survey Nos 272 and 273 situate being and lying at Mouje Okaf taluka City in the registration District Ahmedabad and sub District (Paldi) Bounded as under: East: Road & Shed No 183, West: Shed No 141, North:	25.05.2024 Physical Possession				
(Co-Borrower / Mortgagor), Mr. Karnpratap Rajeshkumar Singh Branch: Memnagar Road Mr. Pravinbhai Ramnikbhai Patel Branch: Paldi Mr. Pravinbhai Ramnikbhai Patel Paldi Mr. Paldi Paldi Mr. Pravinbhai Ramnikbhai Patel Paldi Mr. Paldi Paldi Mr. Paldi Paldi Mr. Paldi Paldi Physic Possess Physic Physic Possess P	2	Guarantors - M/s SLS Industries Pvt. Ltd., Shri Shantilal P Sanghavi, Smt. Manjula S Sanghavi, Shri Mahesh S Sanghavi, M/s. Optima Stainless Pvt. Ltd. Branch: Ahmedabad Recovery	Rs. 26,77,87,955.42/- (Rs. Twenty Six Crore Seventy Seven Lakh Eighty Seven Thousand Nine Hundred Fifty Five and	Admeasuring 50.69 sq.mtrs (as per Municipal tax Bill) in the scheme Avanti Habitat of Navroj Apartment Co. Operative Housing Society Ltd. Constructed on the non Agriculture land bearing Old survey no. 200 & 201/2 Paiki Final Pto No. 265 City Survey No. 7520 of Town Planning Scheme no. 14 Situated at being & lying at Mouje Dariapur Kazipur Taluka City District Ahmedabad, Registration and Sub District Ahmedabad - 6 (Naroda), bounded as: On or towards East by: Flat No. D/5, or towards West by: Flat No. D/3, or towards North by:	26.05.2024 Physical Possession				
Rs. 21.41,590.48/- (Rs. Twenty One Lakh Forty One Thousand Five Hundred Ninety and Forty Eight Paise Only) Rs. 24.41,865.31/- (Rs. Twenty One Thousand Branch: Santram Mandir Road Santram Mandir Road Santram Mandir Road Santram Mandir Road Rs. 24.41,865.31/- (Rs. Twenty One Thousand Branch: Santram Mandir Road Santram Mandir Road Santram Mandir Road Santram Mandir Road Rs. 24.41,865.31/- (Rs. Twenty One Thousand Eight Hundred Sixty Five and Thirty One Paise Only) Thousand Eight Hundred Sixty Five and Thirty One Paise Only) Santram Mandir Road	3	(Co-Borrower / Mortgagor), Mr. Karnpratap Rajeshkumar Singh	Rs. 17,97,550.00/- (Rs. Seventeen Lakh Ninety Seven Thousand Five Hundred Fifty	Near Madhav Farm, Odhav, Ahmedabad - 382415, owned by Mrs. Kamala Rajeshkumar Singh and Mr. Kampratap Rajeshkumar Singh. Bounded as under: East: Society Road, West:	25.05.2024 Physical Possession				
Deepakbhai Gopalbhai Shah Branch: Santram Mandir Road Four Lakh Fourty One Thousand Eight Hundred Sixty Five and Thirty One Paise Only) Thirty One Paise Only) Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Sq.mt. Paiki Estem side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki p	4		Rs. 21,41,590.48/- (Rs. Twenty One Lakh Forty One Thousand Five Hundred Ninety and Forty	undivided share in common construction 19.30 sq.mtrs. total construction 80.26 sq.mtrs. i.e. 96 sq.yds super built up area in the scheme sattva-2, Nr. Eklavya School, Nirant Cross Road, Mouje Vastral, Ahmedabad - 382418 Bounded: North: Internal Small Road, South: Building Margin & School, East: Building Margin & Eklavya School, West: Passage and	25.05.2024 Physical Possession				
Date: 25.05.2024, 26.05.2024, 29.05.2024 Sd/- Authorised Office		Deepakbhai Gopalbhai Shah Branch: Santram Mandir Road	Rs. 24,41,865.31/- (Rs. Twenty Four Lakh Fourty One Thousand Eight Hundred Sixty Five and Thirty One Paise Only)	Sq.mt. Paiki 1834 Sq.Mt. Paiki Estern side paiki plot No. A/7, admn. 161.50 Sq.Mt. paiki Ground floor Construction admn. 78.75 Sq.Mt. and first floor construction admn. 78.75 Sq.Mt. Total construction admn. 157.50 Sq.Mt. known as A/7, Shree Hari Park, Indira Gandhi Marg, Near Petlad Railway Crossing, Nadiad - 387 002 Within the registration Sub - district Nadiad and District Kheda (Gujarat). Boundaries: East: Plot No. A/2, West: Society Road then Open Plot, North: Plot No. A/6, South: Plot No. A/8.	Symbolic Possession				

RDC Concrete (India) Private Limited

CIN: U74999MH1993PTC172842

Regd. Office: DIL Complex, 701, 7th Floor, Thane One, Ghodbunder Road, Majiwade, Thane - 400610, Email: manish.modani@rdcconcreteindia.com Phone: +91 9930999791 Website: www.rdcconcrete.com

EXTRACT OF STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED

		Standalone						
Sr	Particulars				Consolidated			
No			Quarter ende		5,50,500	ended		ended
		31-Mar-24	31-Dec-23	31-Mar-23	31-Mar-24	31-Mar-23		31-Mar-23
_	Total Income from Organian	Unaudited 5.800.99	Unaudited 4.829.39	Unaudited 4,257,26	Audited 19,700,59	Audited	20,360.64	Audited
1	Total Income from Operations		.,	, , , , , , , , , , , , , , , , , , , ,	uner/ i verceureve	14,410.49	The second secon	14,609.13
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	273.00	61.55	217.61	511.42	443.65	545.74	436.80
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	273.00	61.55	217.61	511.42	443.65	545.74	436.80
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	195.54	49.06	140.21	387.48	294.74	410.61	294.80
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	193.31	49.43	140.38	385.95	295.40	409.36	295.44
6	Paid up Equity Share Capital	554.15	554.15	86.75	554.15	86.75	554.15	86.7
7	Reserves (excluding Revaluation Reserve)	310.17	-64.83	165.68	967	331.01	505.59	299.3
8	Securities Premium Account	467.01	-13.79	0.09	516.90	63.68	516.90	63.6
9	Net worth	1,521.15	1,311.82	417.76	1,521.15	417.76	1,646.01	519.2
10	Paid up Debt Capital/ Outstanding Debt	71.56	251.59	65.73	3,734.03	2,727.06	3,983.76	2,741.0
11	Outstanding Redeemable Preference Shares	-	-	4,67,39,910	-	4,67,39,910	-	4,67,39,91
12	Debt Equity Ratio	2.45	2.79	6.53	2.45	6.53	2.42	5.2
13	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -							
	1. Basic:	3.53	0.89	16.16	10.28	33.98	10.90	33.9
	2. Diluted:	3.41	0.85	2.74	7.16	6.31	7.56	6.3
14	Capital Redemption Reserve		-				-	
15	Debenture Redemption Reserve	-	-	-	-	-	-	
16	Debt Service Coverage Ratio	1.11	0.8	1.57	1.17	1.45	1.19	1.7
17	Interest Service Coverage Ratio	3.38	2.86	5.32	3.19	4.31	3.22	4.6
18	Current Ratio	0.87	0.9	0.93	0.87	0.93	0.88	0.9
19	Long Term Debt to Working Capital Ratio	119.53	12.28	14.66	119.53	14.66	22.53	6.0
20	Bad Debt to Account Receivable Ratio (%)	1.64%	0.01%	0.72%	1.66%	0.80%	1.62%	0.79%
21	Current Liability Ratio	0.76	0.76	0.68	0.76	0.68	0.73	0.6
22	Total Debt to Total Assets Ratio	0.3	0.32	0.32	0.3	0.32	0.3	0.3
23	Debtor's Turnover	1.06	0.89	1.05	3.6	3.58	3.66	3.8
24	Inventory Turnover	19.76	17.74	20.75	66.91	70.58	64.39	67.4
25	Operating Margin Percentage	10.42%	7.25%	10.28%	8.44%	8.43%	8.85%	8.559
26	Net Profit Margin Percentge	4.71%	1.27%	5.11%	2.60%	3.08%	2.68%	2.99

#-Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

1 The Company has adopted Indian Accounting Standards (Ind AS) as notified by the Ministry of Corporate Affairs with effect from April 1, 2019, with a transition date of April 1, 2021 for all periods upto and including the quarter and year ended March 31, 2024.

2 The above is an extract of the Audited Financial Results for the quarter and year ended March 31, 2024 filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the quarter and year ended

March 31, 2024 are available on the BSE Ltd. (URL: https://www.bseindia.com) and on the website of the Company (URL: https://www.rdcconcrete.com) 3 There has been no change in the accounting policies and therefore there has been no impact on net profit/ loss, total comprehensive income or any othe relevant financial item(s).

For RDC Concrete (India) Private Limited

PUBLIC NOTICE

Notice hereby given that certificate(s) in respect of below mentioned Equity shares of the M/s. Cera Sanitaryware Limited ('Company') has/have been lost/misplaced stolen and the holder(s) of the said shares Mr./Mrs. Ratan Devi Kumawat (Ratan Kanwe Kumawat) has/have applied to the Compan for issue of Duplicate share certificate(s) in lieu of the Original Share Certificate No. 7035 & 15737 belonging to Folio No. 00004374 Any person having claims/objections in the said shares, should communicate to the Company at the Registered Office of the Company within 15 days from the date of publication of this notice, failing which the Company shall proceed to issue Duplicate Share Certificates.

GAUTAM GEMS LIMITED CIN NO: L36911GJ2014PLC078802 Address: 3rd Floor, Office: 301, Sumukh Super Compound, Vasta Devadl Road, Surat - 395004 Website: www.gautamgems.com || Contact: 0261-2538046 || Email: complianceggl@gmail.com STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE

	QUARTER AND YEAR ENDED O	N 31ST N	IARCH, 2	024	(R	s. in Lakhs)
Sr. No		Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited
2	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	2826.50 -27.24 -18.24 0.00 4284.61 	7332.02 79.5 61.5 0.00 4284.61 	2983.17 -37.55 -28.05 0.00 4284.61 	10158.52 52.26 38.26 0.00 4284.61	9164.24 48.56 35.41 0.00 4284.61

Notes: (A) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30-05-2024 (B) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. (C) The above is an extract of the detailed format of Annual Financial Results filled with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (D) The figures for the previous year/periods are re-arranged/regrouped, wherever considered necessary.

For and on behalf of Gautam Gems Limited sid-Gautam P. Sheth. Managing Director - DIN: 06748854 sd/- Gautam P. Sheth, Managing Director - DIN: 06748854



GUJARAT TERCE LABORATORIES LIMITED

Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat) Phone: - 079 - 35200400, CIN NO: L24100GJ985PLC007753

email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024.

[Rs.ln Lakhs except per share detail]							
Dowllow	Quarter Ended Financial Year End				ear Ended		
Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023		
Total income from operations	1220.71	1302.02	1288.85	4797.47	4678.25		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional							
and/or Extraordinary items)	84.39	67.28	-41.89	54.39	-289.39		
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional							
and/or Extraordinary items)	84.39	67.28	-41.89	54.39	-289.39		
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional							
and/or Extraordinary items)	54.34	67.28	80.34	24.34	-167.16		
Total Comprehensive Income for the period [Comprising							
Profit /(Loss) for the period (after tax) and Other							
Comprehensive Income (after tax)]	54.34	67.28	80.34	24.34	-167.16		
Equity Share Capital	742.03	742.03	742.03	742.03	742.03		
Reserves (excluding Revaluation Reserve)	-31.42	-85.76	-55.76	-31.42	-55.76		
Earnings Per Share (of Rs.10/- each)							
Basic & Diluted:	0.73	0.91	1.08	0.33	-2.25		

I The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the Company in its meeting held on 29/05/2024 and same are also been reviewed by the statutory auditors of the Company.

2 The Above Audited Results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated August, 10, 2016.

The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended on March 31, 2024 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of standalone Audited financial results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.qujaratterce.in.

> By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited

Aalap Prajapati (Managing Director and CEO) DIN: 08088327

INTEGRA

Place: Ahmedabad Date: 29.05.2024

INTEGRA ENGINEERING INDIA LIMITED

CIN: L29199GJ1981PLC028741

Registered Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat. Tel. No.: +91 90999 18471, Fax No.: +91-2676-220887,

Email ID: info@integraengineering.in Website: www.integraengineering.in

Statemo	ent of Audited Standaione Financial Results for the Qua	rter and tear er	1aea 31st March	, ZUZ4 (7 in Lakins)
Sr. No.	Particulars	Quarter ended 31.03.2024	Year ended 31.03.2024	Quarter ended 31.03.2023
1	Total income from operations	3,363.36	14,767.19	3,586.67
2	Net Profit / (Loss) for the period before Tax	383.54	2,102.19	627.81
3	Net Profit / (Loss) for the period after Tax	269.52	1,452.04	477.04
4	Total Comprehensive Income for the period	276.03	1,457.59	472.01
5	Equity Share Capital	343.65	343.65	343.65
6	Other Equity		7,335.68	-
7	Earnings per share of ₹ 1/- each			
	(1) Basic	0.78	4.23	1.39
	(2) Diluted	0.78	4.23	1.39

Note: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

Place: Halol Date: 30.05.2024

Bank of India

For INTEGRA Engineering India Limited Shalin Sunandan Divatia

INTEGRA

INTEGRA ENGINEERING INDIA LIMITED

CIN: L29199GJ1981PLC028741

Registered Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat.

Tel. No.: +91 90999 18471, Fax No.: +91-2676-220887,

Email ID: info@integraengineering.in Website: www.integraengineering.in

Stateme	ent of Audited Consolidated Financial Results for the Qua	arter and Year ei	nded 31st March	, 2024 (₹ in Lakhs)
Sr. No.	Particulars	Quarter ended 31.03.2024	Year ended 31.03.2024	Quarter ended 31.03.2023
1	Total income from operations	3,363.36	14,767.19	3,586.67
2	Net Profit / (Loss) for the period before Tax	383.54	2,102.19	627.81
3	Net Profit / (Loss) for the period after Tax	269.52	1,452.04	477.04
4	Total Comprehensive Income for the period	276.03	1,457.59	472.01
5	Equity Share Capital	343.65	343.65	343.65
6	Other Equity	-	7,335.68	_
7	Earnings per share of ₹ 1/- each			
	(1) Basic	0.78	4.23	1.39

Note: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com)

For INTEGRA Engineering India Limited Shalin Sunandan Divatia

Director

0.78

SWARNSARITA JEWELS INDIA LIMITED

(Earlier known as Swarnsarita Gems Limited) Regd. Office: 10, Floor First, Plot 40/42, 1E, Ruby Chamber, Dhanji Street, Zaveri Bajar, Mumbadevi Mandvi ,Mumbai-400003, Maharashtra
Corp. Address: 104, First Floor, 17/19, Swarn House, Dhanji Street, Zaveri Bazaar Mumbai-400002
CIN: L36911MH1992PLC068283 Tel. No.: 022-43590000 E-mail: info@swarnsarita.com Website: www.swarnsarita.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED 31 ST MARCH 2024

						(Rs. In Lacs	except EPS)
			STANDALONE			CONSOLIDATED	
PARTICULARS	QUARTER ENDED		YEAR ENDED		YEAR ENDED		
	31.03.2024 Audited	31.12.2023 Unaudited	31.03.2023 Audited	31.03.2024 Audited	31.03.2023 Audited	31.03.2024 Audited	31.03.2023 Audited
Total income from operations	15413.01	17511.26	13974.06	68116.85	84765.80	76969.32	83990.11
Net Profit / (Loss) for the period (Before Tax & Extraordinary Items)	109.81	3.56	137.41	690.62	681.85	661.47	841.11
Net Profit/(Loss) for the period (After tax & extraordinary items)	73.03	2.67	107.21	508.64	510.10	479.31	629.16
Total Comprehensive Income for the period [Comprising Profit/Loss							
for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	80.58	2.67	101.57	516.19	504.46	486.86	623.52
Paid up Equity Share Capital							
(Face Value of Rs.10/- each fully paid up)	2083.76	2083.76	2083.76	2083.76	2083.76	2083.76	2083.76
Reserves (excluding Revaluation Reserve as shown in the							
Balance Sheet of previous year ended 31.03.2023)	9743.46	9743.46	9743.46	9743.46	9743.46	9694.27	9694.27
Earnings Per Share (before & after extraordinary items)							
(face value of Rs.10/- each)							
a) Basic:	0.35	0.01	0.51	2.44	2.44	2.30	3.01
b) Diluted:	0.35	0.01	0.51	2.44	2.44	2.30	3.01

Place: Mumbai

Place: Halol

Date: 30.05.2024

The above is an extract of the detailed format of Year Ended Financial Result filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure


Requirements) Regulation, 2015. The full format of the Year Ended Financial Results are available on the website of the Stock Exchange i.e. www.bseindia.com. The same are also available on the Company website i.e. www.swarnsarita.com.


Figure of the previous period have been regrouped/rearranged wherever necessary to make them comparable with Current figure.

FOR SWARNSARITA JEWELS INDIA LIMITED

SUNNY MAHENDRA CHORDIA WHOLE-TIME DIRECTOR Date: 29th May, 2024 DIN: 06664041

Anil Banchhor Managing Director & CEO DIN: 03179109





લોકસભા-૨૦૨૪



સાતમાં તબક્કાનું આવતીકાલે મતદાન થશે

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા

शनिवारे वोटिंग थशे अने ४ लूने

પરિણામ સામે આવી જશે. લોકસભા

ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા

નવી દિલ્હી. તા.૩૦ ૧૯ એપ્રિલથી શરુ થયેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે હવે ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. સાતમા અને છેલ્લા તબક્કો માટે પ્રચાર કરવાનો આંજે ગુરુવારે અંતિમ દિવસ હતો. હવે તેના માટે

સાતમા અને છેલ્લા તબક્કા અંતર્ગત ૧ જૂને ૮ રાજ્યો તથા સંઘ શાસિત પ્રદેશોની પ૭ લોકસભા સીટો પર મતદાન

અંતર્ગત ૧ જૂને ૮ રાજ્યો તથા સંઘ શાસિત પ્રદેશોની ૫૭ લોકસભા સીટો પર મતદાન થશે. સાતમા તબક્કાની આ ચૂંટણી કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ સાથે સાથે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી માટે કેટલીય રીતે મહત્વની થવા જઈ રહી છે. આ ૫૭ સીટો પર ૨૦૧૯માં થયેલી ચૂંટણી પરિણામની વાત કરીએ તો, ભાજપે એકલા ૨૫ સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જો કે, બાદમાં હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી આ સીટ આંચકી લીધી હતી. તો વળી ભાજપના સહયોગી દળોની વાત કરીએ તો, જેડીયૂના ખાતામાં ૩ અને અપના દળના ખાતામાં ૨ સીટો આવી હતી. કુલ મળીને એનડીએ ગઠબંધન પાસે ૩૦ લોકસભા સીટો હતો અને મંડી લોકસભા પેટાચૂંટણીના પરિણામ બાદ આ ગઠબંધન પાસે ૨૯ સીટો રહી ગઈ હતી.

ઓરિસ્સામાં હારજિત કોઇની પણ થાય રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સર્જાશે રેકોર્ડ

ઓરિસ્સામાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીઓ પણ થઇ રહી છે. સત્તારૂઢ બીજુ જનતાદળ અને વિપક્ષી દળ ભાજપા બન્ને પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરવાનો દાવો કરી રહ્યાં છે. પરંતુ મતદાતાઓના મનમાં શું છે તે તો મતગણતરી વખતે જાણી શકાશે.

પ્રજા માનસમાં એક સવાલ ચકરાઇ રહ્યો છે કે, શું લગાતાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે? પણ ઓરિસ્સાના લોકોમાં દિલચસ્પ એ વાતની છે કે, શું નવીન પટનાયક લગાતાર છદ્દી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે ખરા? ૨૪ વર્ષ મુખ્યમંત્રી રહેવા છતાં પટનાયકની વિરૂધ્ધ સત્તા વિરોધી સહેર ક્યાંય પણ દેખાતી નથી. વાતચિતનો નીચોડ

એ પણ નીકળે છે કે, જ્યાં દિલ્હીની સત્તા માટે મોદી પ્રથમ પસંદ છે ત્યાં રાજ્યની સત્તા માટે નવીન પટનાયકની તુલનામાં બીજું કોઇ નામ ભાજપા સત્તા માટે અને નજરે નથી આવતું. રાજ્ય

બીજેડી સત્તા બચાવવા લગાવશે પુરું જોર

सरकारनी सेवामांथी निवृत्त થયેલા મહાનુભાવે કહ્યું કે, મોદીનો કોઇ વિકલ્પ નથી. અહીં જો કે, મફત ચોખા, નિઃશુલ્ક

શિક્ષણ અને સ્વસ્થ્ય નવીન બાબુની ખાસ રાજનિતીક પૂંજી છે. તેમનો વિરોધ વિપક્ષ પણ કરી શકે નહીં. કોઇકે કહ્યું કે, પટનાયકબાબુ કેવળ યોજનાઓ નથી બનાવતા તેને કાર્યાન્વિત પણ કરે છે.

ઉત્તર ભારતના રાજ્યોની માફક સપ્તાહભર ઓરિસ્સા પણ તપી રહ્યુંછે. પરંતુ ચક્રવાતી તોફાન રેલમના પગલે ત્યાં મોસમ સુહાની હોવાનું જણાય છે. અલબત્ત ચૂંટણીનું આખરી ચરણ આવતા આવતા રાજ્યનો રાજનીતિક પારો પહેલુથી વધારે વધી જશે. દશકાઓ સુધી રાજ્યમાં સત્તારૂઢ બની રહેલ કોંગ્રેસ સ્થાનિક રાજનીતિમાં પોતાની પકડ ગુમાવી ચૂકે છે. ક્યારેક સાથે સાથે ચાલી ચુકેલા બીજુ જનતાદળ અને ભાજપ હવે એક બીજાથી રાજનીતિક અંતર બનાવી બેઠા છે. નવીન બાબુની સરકારથી લોકો સંતુષ્ટ છે. પરંતુ એમની વધતી ઉંમર અને પાર્ટીમાં ખેંચતાણના પગલે આ વખતે મુકાબલો જોરજાર બની રહેશે. પ્રથમ ત્રણ ચરણમાં મતદાનની ટકાવારી ઠીકઠાક રહી, ચૂંટણી જિતવા માટે ભાજપાના દેશભરથી આવેલા નેતાઓએ અહીં ડેરાતંબુ

ગિફ્ટ નિફ્ટીએ મેમાં ૮૮.૧૦ બિલિયન ડોલરનું ઓલ-ટાઇમ હાઇ માસિક ટર્નઓવર કર્યું

GIFT નિફ્ટીએ, જે ભારતીય ઇક્વિટી માર્કેટની વૃદ્ધિની વાર્તાના નવા માપદંડ તરીકે ઊભું છે, તેણે એક નવો માઇલસ્ટોન નોંધાવ્યો છે અને મે ૨૦૨૪ માં યુએસ ઇં૮૮.૧૦ બિલિયનનું ઓલ-ટાઇમ હાઇ મંથલી ટર્નઓવર હાંસલ કરવાના સંદર્ભમાં તેની કેપમાં વધુ એક મોરપીંછ ઉમેર્યું છે. ૩૦ મે, ૨૦૨૪ ના રોજ પ્રથમ સત્રના અંતે. આ નોંધપાત્ર સિદ્ધિ એપ્રિલ ૨૦૨૪માં સેટ કરેલા યુએસ ઇં ૮૨.૦૪ બિલિયનના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે.

આ માઈલસ્ટોન GIFT નિફ્ટીમાં વધતી જતી વૈશ્વિક રુચિ અને વિશ્વાસને ભારતની વૃદ્ધિ વાર્તાના માપદંડ

તરીકે દર્શાવે છે. અમે GIFT નિફ્ટીની સફળતાના સાક્ષી બનવા માટે પ્રસન્ન છીએ અને તમામ સહભાગીઓને તેમના જબરજસ્ત સમર્થન અને GIFT નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ તેમનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજ GIFT નિફ્ટીની સંપૂર્ણ-સ્કેલ કામગીરી શરૂ થઈ ત્યારથી એનએસઇ ૈંઠ પર ટ્રેડિંગ ટર્નઓવર

Change Of Name ઝડપથી વધી રહ્યું છે. પૂર્ણ-

OLD NAME MEENABEN २ ५ PRAKASHBHAI PATEL NEW કામગીરીના NAME MINAXIBEN પ્રશામ PRAKASHBHAI PATEL Address: 17, SWAGAT દિવસથી, BUNGLOWS, MANIPURA ગિફ્ટનિફ્ટીએ ROAD, VIJAPUR, Mahsana PIN 382870, (GUJARAT) કુલ ૧૮.૮૪ મિલિયન

Change Of Name क्षेन्ट्राक्ट्स

સાથે કુલ My Changed Name સં ચિત From Kapilabahen Patel વોલ્યુમ જોયું To Kapilaben Patel છે. ૩૦ મે, 82, Galaxy Bungalow, Nikol-Naroda Road, ૨૦૨૪ ના Ahmedabad રોજ પ્રથમ

નામ બદલેલ છે

સુધી US મારું જૂનું નામ મીનાબેન \$782.08 પ્રકાશભાઈ પટેલ થી બદલીને નવું બિલિયનનું નામ મીનાક્ષીબેન પ્રકાશભાઈ પટેલ કુલ સંચિત કરેલ છે. સરનામું : ૧૭, સ્વાગત ટર્નઓવર બંગ્લોઝ, મણિપુરા રોડ, વિજાપુર થયું છે. મહેસાણા-૩૮૨૮૭૦ (ગુજરાત)

સગના અંત

સ્થળ: અમદાવાદ

તારીખ: ૩૧.૦૫.૨૦૨૪

કેજરીવાલને જામીન અરજી પર કોર્ટમાં રાહત ન મળી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરેન્ડર કરવાની ડેડલાઈનથી ફક્ત ૩ દિવસ પહેલા ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આપના સંયોજકની અરજી પર કોર્ટેર વાગ્યે સુનાવણી કરી હતી પરંતુ તેમાં તેમને કોઈ રાહત ન અપાઇ. હવે આ મામલે ૧ જૂને બપોરે ૨ વાગ્યે સુનાવણી હાથ ધરાશે.

ઓમકારા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસઃ ૯, એમ.પી.નગર, ૧લી શેરી, કોન્ગુ નગર એક્સ્ટે., તિરુપુર -૬૪૧૬૦૭ કોર્પોરેટ ઓફિસઃ કોહિનૂર સ્ક્વેર, ૪૭મે માળે, ન.ચિ.કેળકર માર્ગ, રા.ત્ર.ગડકરી ચોક, દાદર (પશ્ચિમ) મુંબઈ- ૪૦૦૦૨૮

ડિમાન્ડ નોટિસ

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨(કાયદો)ન ક્શન ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટિસ

સંકશન ૧૩(૨) હેઠળ રિમાન્ડ નાર્ટિસ તમે નીચે ઉલ્લેખ કરાયેલ દેવાદારો, સહ-દેવાદારો, જામીનદારો/ગિરવેદારોએ નીચે જજ્ઞાવેલ મિલકત/તો ગિરવે મૂકીને ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ(હવે પછી અસલ પિરાણદાર/એસાઇનર તરીકે ઉલ્લેખ થશે) પાસેથી નાણાંકીય સહાય મેળવેલ છે. વધુમાં આ પિરાણની પરત ચૂકવણીમાં ક્સૂર કરવાને કારણે, પિરાણ ખાતું નોન-પરકોર્મિંગ અસ્ક્યામત તરીકે ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ દ્વારા જાહેર કલે છે. અસલ પિરાણદાર બિન્શરતી અને ૨૬ ન કરી શકાય તે રીતે નીચે જણાવેલ લોન ખાતાઓ અન્ડરલાઈંગ સિક્યોરિટી સાથે ઓમકારા એસેટ્સ રિક્નસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ(હવે પછી ઓએઆરપીએલ તરીકે ઉલ્લેખાશોને જે ઓમકારા પીએસ ૩૦/૨૦૨૧-૨૨ના ટ્રસ્ટી તરીકે પોતાની શ્રમતામાં કાર્યરત છે તેને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ના એસાઇનેસ્ટ એચીમેન્ટથી એસાઇન કરેલ છે. આ એસાઇન્મેન્ટ અનુસાર, અસલ પિરાણદારના તમામ અધિકારો ઓએઆપારીએલને નજલ્લિ હન્યમાં આવ્યા છે. એએઆપારીએલ હતે ઇંચિલિ પ્રણાયાઓ એસ્ટી ઉપલેખ પ્રિયોદ છે. એચી ઉપાયો ક્લેએ સ્

એઆરપીએલને તબદિલ કરવામાં આવ્યા છે.ઓએઆરપીએલ હવે સંબંધિત ધિરાણખાતાઓ સંબંધે સિક્યો ડે લેણદાર છે.ઓએપીઆરએલને સદ રાણખાતાઓમાં બાકી રહેલ લેજ્ઞા વસૂલ કરવા માટે સરફૈસી કાયદાની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરવા માટે તમામ સત્તા, અધિકાર અને ટાઇટલ સદર એશ્રીમેન્ટ અને બાકી લેજ્ઞાની વસૂલાત માટે ઓએઆરપીએલએ કાયદાના સેક્શન ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટિસ મોકલેલ, જેમાં નીચેના દેવાદાર(રો)ને, અસલ ધિરાજ્ઞદાર અને દેવાદાર(રો)/સહ-દેવાદારો/ગિરવેદારો વચ્ચે થયેલ ધિરાજ્ઞ કરાર હેઠળ દરેક ધિરાજ્ઞ ખાતા સંદર્ભમાં, દેવાદાર(રો) દ્વારા બીજા કોઈ દસ્તાવેજ કરાયેલ હોય તે સાથે વંચાજો લેતા સંબંધિત ડિમાન્ડ નોટિસમાં આપેલ રકમોની પરત ચૂકવણી કરવા જજ્ઞાવેલ છે જેની વિગતો

. દેવાદાર/સહ-દેવાદાર/ગિરવેદાર, ધિરાણખાતા નંબર, સેક્શન ૧૩(૨) હેઠળની ડિમાન્ડ નોટિસની તારીખ, ડિમાન્ડ નોટિસમાં આપેલ રકમ અને શરવે મિલકતનું વર્ણન નીચે મુજબ છે:

certaining the megoto.			
દેવાદાર/સહ-દેવાદાર/ગિરવેદારનું નામ	ધિરાણ ખાતા નં.	સે. ૧૩(૨)) હેઠળ ડિમાન્ડ નોટિસની તારીખ	સે. ૧૩(૨)) હેઠળ જણાવેલ રકમ
. વ્રજાનંદ એલ્યુમિનિયમ (દેવાદાર), પ્રોપ્રા. પિયૂપ શાહ), ાયૂપ શાહ (પ્રોપ્રાયટર, જામીનદાર અને ગિરવેદાર), ાલતી પિયૂપ શાહ(જામીનદાર)	૫૧૮૦૦૩૪૦૭૭૧૪ અને ૬૫૦૦૧૪૦૬૧૮૧૦	922 2 8 8	રૂ.૧,૫૦,૨૧,૭૪૭.૪૯ (અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ એકવીસ હજાર સાતસો સુડતાલીસ અને પૈસા ઓગણપચાસ પૂરા)
ગેરવે મિલકતનું વર્ણન મિલકત નં ૧:સ્થાવર સંપત્તિ તેમો	જે બાપોદ ગજિસ્ટેશ	ાન પેટા જિલ્લો અને જિલ્લો	વરોદરા ખાતે આવેલ રેગ નં ૯૭૨

એફ પી. નં. ૫૧૮, ૫૧૯, ૫૩૭ અને ૫૩૯ એરિયા માપશી ૧૨૩૭૨ ચો.મી. જમીન પર બંધાયેલ વાઘેશ્વરી સોસાયટીમાં પ્લોટનં. બી-પ૯, માપશી ૧૧૭.૮૦ ચો.મી., અવિભાજિત જમીન માપણી ૧૩૭.૮૦ ચો.મી., બિલ્ટ અપ ઓરયા માપણી પ૪.૩૭ ચો.મી.મિલકતના તમામ અધિકારો, ટાઇટલ અને હિતો. સીમાઓ છેઃ પૂર્વે : માર્જિન છોડેલ, ૭.૫૦ મી. ટીપી રોડ, પશ્ચિમઃ માર્જિન છોડેલ, બ્લોક નં. બી-૬૨, ઉત્તરેઃ બ્લોક નં. બી-૬૦, દક્ષિણે: માર્જિન છોડેલ, બ્લોક નં, બી-૫૮, મેલકત નં.૨ઃ સ્થાવર મિલકત તે મોજે બાપોદ, રજિસ્ટ્રેશન પેટા જિલ્લો અને જિલ્લો વડોદરા ખાતે આવેલ રે.સ. નં. ૯૭૧, ટી.પી. નં. ૫૪, એફપી

નં. ૫૨૦ પૈકી માપણી ૮૩૭ ચો.મી. ધારક જમીન પર બંધાયેલ ગોકુલ ઉપવનના નામે અને શૈલીની સ્કિમમાં દુકાન નં. ૪, ભોંયતળિયે, માપણી ૨૫૦ચો.ફીટ, સુપર બિલ્ટ અપ એરિયા, અવિભાજિત જમીન અને કોમન એરિયા માપણી ૧૫૬ ચો.ફીટ મિલકતના તમામ અધિકારો, ટાઇટલ અને હિતો. સીમાઓ છેઃ પૂર્વે ઃ મેઇન રોડ, પશ્ચિમઃ પાર્કિંગ, ઉત્તરેઃ દુકાન નં.૫, દક્ષિણેઃ દુકાન નં.૩.

આથી દેવાદાર(રો)/સહ-દેવાદારો/જામીનદારો/ગિરવેદારોને નોટિસ આપવાની કે ઉપર જણાવેલ માંગણા રકમ થનાર વ્યાજ સાથે આ નોટિસની તારીખથી દિન ૮૦માં ચૂકતે કરી જવી, જેમાં કસૂર થયેથી નીચે સહી કરનારને નાછૂટકે ઉપર જણાવેલ સિક્યોરિટીઝ પર કાયદા અન્વયે કાર્યવાહી કરવાની કરજ પડશે. મહેરબાની કરીને નોંધ લેવી કે સદર કાયદાના સેક્શન ૧૩(૧૩) મુજબ તમો તમામને ઓએઆરપીએલની લેખિત પૂર્વમંજૂરી વિના ઉપરોક્ત અસ્ક્યામતો વેચાણ, લિઝ અથવા અન્ય કોઈ રીતે, તબદિલ કરવા સામે મનાઈ

ફરમાવવામાં આવે છે. કાયદા કે તે હેઠળના નિયમોની જોગવાઇઓનો ભંગ કરનાર કોઈ પણ શખ્સ કાયદા હેઠળ કેદ અને /અથવા દંડને પાત્ર

તા. ૩૧.૦૫.૨૦૨૪ સ્થળઃ ગુજરાત

OMKARA

અધિકૃત અધિકારી વતી ઓમકારા એસેટ્સ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટે (ઓમકારા પીએસ ૩૦/૨૦૨૧-૨૨ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પોતાની ક્ષમતા મુજબ કાર્યરત)

K.Z. LEASING AND FINANCE LTD. CIN: L65910GJ1986PLC00864 Reod. Office : Deshna Chambers, B/h, Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014, Phone : 079-27543200 EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER AND YEAR ENDED 31/03/2024 (Rs. in Lakhs)

'	HE QUARTER AND TEAR END	ED 31/	03/202	.4	(RS.	in Lakns)
SN	r o Particulars	Quarter ended on 31/03/2024 Audited	Quarter ended on 31/12/2023 Unaudited	Quarter ended on 31/03/2023 Audited	Year ended on 31/03/2024 Audited	Year ended on 31/03/2023 Audited
1 2 3 4 5	Net Profit / (Loss) from ordinary activities before tax Net Profit / (Loss) for the period after tax Paid-up Equity Share Capital (Share of Rs.10/- each) Reserves (excluding Revaluation reserve as shown in the Balance Sheet of Previous year)	(63.30) (221.90) (163.98) 304.12	122.64 50.07 37.05 304.12	40.73 (31.45) (41.97) 304.12	485.61 170.41 72.14 304.12	195.41 39.18 28.66 304.12
6	Earnings per share (EPS) - Basic - Diluted	(5.39) (5.39)	1.22 1.22	(1.38) (1.38)	2.37 2.37	0.94 0.94

Company at its meeting on 30/05/2024. The above results have been reviewed by the Statutory Auditors of the Company (2) The above is an extract of the detailed format of Quarterly financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI(Listing Obligations and Disclosure requirements) Regulation 2015. The full format of financia results is available on the Company's website www.kzgroup.inand Stock Exchange website www.bseindia.com Place: Ahmedabad For, K.Z. Leasing & Finance Ltd.

sd/- Pravinkumar K. Patel, Managing Director - DIN: 00841628

GAUTAM GEMS LIMITED CIN NO: L36911GJ2014PLC078802 Address: 3rd Floor, Office: 301, Sumukh Super Compound, Vasta Devadi Road, Surat - 395004 Website: www.gautamgems.com || Contact: 0261-2538046 || Email: complianceggl@gmail.com TATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE

	QUARTER AND YEAR ENDED O	N 31ST M	IARCH, 2	024	(R	s. in Lakhs)
Sr. No		Quarter ended on 31-03-2024 Audited	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2024 Audited	Year ended on 31-03-2023 Audited
1 2 3 4 5 6	Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve	2826.50 -27.24 -18.24 0.00 4284.61	7332.02 79.5 61.5 0.00 4284.61	2983.17 -37.55 -28.05 0.00 4284.61	10158.52 52.26 38.26 0.00 4284.61	9164.24 48.56 35.41 0.00 4284.61
7	Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	-0.04	0.14	-0.15	0.09	0.19

Notes: (A) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved Notes: (A) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30-05-2024 (B) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. (C) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (D) The figures for the previous year/periods are re-arranged/regrouped, wherever considered necessary.

For and on behalf of Gautam Gems Limited

Courtson P. Shoth Magazing Discotor, 2018, 105748954. sd/- Gautam P. Sheth, Managing Director - DIN: 06748854 Place : Surat || Date : 31/05/2024

PALM JEWELS LTD. CIN: L36910GJ2005PLC046809 Registered Office : C/205, D/205, 2nd Floor, Super Mall, Besides Lal Bungalow, C.G. Road, Ahmedabad, Gujarat, 380005 || Email id : compliance.pjl@gmail.com; || Tel. No. : +91-079-40052056; || Web : www.palmjewels.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2024 (Rs. in Laki Quarter Quarter Quarter 31-03-2024 31-12-2023 31-03-2023 31-03-2024 31-03-2023 12037.52 35.99 2327.49 15.28 16063.11 45.67 9987.02 39.48 Total Income Net Profit for the year before tax 4025.59 Net Profit for the year after tax Total Comprehensive Income for the year 27.99 27.99 13.28 34.67 30.48 12.92 1004.10 13.28 30.48 1004.10 Paid up Equity Share Capital 1004.10 1004.10 Other Equity Strate Capital
Other Equity Excluding Revaluation Reserve
Earnings per share (Face Value of Rs.10/- each)

Notes: (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 29.05.2024 (b)The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on March 31st, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (d) The figures for the previous year/periods are re-arranged/re-grouped, wherever considered necessary For and on behalf of Palm Jewels Limited sd/- Rohit Shah, Managing Director - DIN: 00543440

0.13

0.28

adani

અદાણી ટોટલ ગેસ લિમિટેડ

(અગાઉ અદાણી ગેસ લિમિટેડ તરીકે જાણીતી)

0.13

0.30

0.35

૧૯મી વાર્ષિક સાધારણ સભા, ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટની નોટિસ તથા ઈ-વોટિંગ માટેની માહિતી

આથી નોટિસ આપવામાં આવે છે કે, **અદાણી ઢોટલ ગેસ લિમિટેડના સભ્યોની ૧૯મી વાર્ષિક સાધારણ સભા** (એજીએમ) મંગળવાર, ૨૫મી જૂન, ૨૦૨૪ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે વિકિઓ કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા ચોજાશે, જેમાં એજીએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ ધરાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના तथा **સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ** બોર્ડ ઓફ ઇન્ડિયાના પરિપત્રો ને ધ્યાનમાં રાખતા , એજાએમની નોટિસ અને વર્ષનો વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ ઇલેક્ટ્રોનિક મોડથી જે સભ્યોના ઈ-મેલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા છે, તેમને મોકલી આપવામાં આવ્યા છે. એજીએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ - www.adanigas.com તથા નેશનલ સિક્યુરિટી ડિપોઝીટરી લિમિટેડની વેબસાઈટ: <u>www.evoting.nsdl.com</u> પર પણ ઉપલબ્ધ છે.

ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ ડેટ

આથી નોટિસ આપવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના કિવિડન્ડ (@ ૨૫% - રૂ.૦.૨૫ દર ઇક્વીટી શેર કે જેની ફેસ વેલ્યુ રૂ. ૧/- કુલ્લી પેઈડ અપ) ની ચુકવણી માટે, જો સભ્યો દ્વારા આગામી વાર્ષિક સામાન્ય સભામાં મંજુર કરવામાં આવે તો , **શુક્રવાર, ૧૪મી જૂન, ૨૦૨૪ને 'રેકોર્ડ ડેટ'** તરીકે નક્કી કરેલ છે. જે સભ્યોના નામ રેકોર્ડ ડેટના દિવસે કંપનીના રજસ્ટર ઓફ મેમ્બર્સમાં નોંધાયેલ હશે તેઓને ઇલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમ દ્વારા રપમી જૂન, ૨૦૨૪ પછી ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.

રિમોટ ઈ-વોટિંગ અને એજીએમ દરમ્યાન ઈ-વોટિંગ

કંપનીઝ એક્ટ ની ક્લમ ૧૦૮ની જોગવાઈઓ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર્સ રિક્વાચરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ના નિયમન ૪૪ અન્વયે, એજીએમની નોટિસમાં વર્ણવવામાં आवेला तमाम हरावो ઉपर सल्योने तेमनो मत छलेड्योनीङली आपवा मार्ट ई-वोटिंगनी सुविधा नेशनल સિક્યુરિટી ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) મારફ્તે પુરી પાડવામાં આવેલ છે. મતના અધિકારો સભ્યો પાસે મંગળવાર, ૧૮મી જૂન, ૨૦૨૪ રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્રાની સંખ્યાના આધારે પ્રમાણસર ગણાશે, કે જે

રિમોટ ઈ-વોટિંગના સમયગાળાની શરૂઆત શુક્રવાર, ૨૧મી જૂન, ૨૦૨૪ (સવારે ૯:૦૦) થી થશે અને સોમવાર, **૨૪મી જૂન, ૨૦૨૪ના રોજ (સાંજે ૫:૦૦)** એ પુરી થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઇલેક્ટ્રોનિક્લી મત આપી શક્શે. એ પછી રિમોટ ઈ-વોટિંગ મોડયુલ ડિસેબલ કરી દેવાશે. રિમોટ ઈ-વોટિંગનો વિકલ્પ નહિ ઉપયોગ કર્ચો હોય અને જે સભ્યો એજીએમ માં વીસી / ઓવીએમ દ્વારા હાજર રહ્યા હશે તે સભ્યો એજીએમમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મત આપી શકશે.

એકવાર સભ્યે કોઈ એક ઠરાવ ઉપર રિમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપી દીધો હોય તો તેઓ વીસી / ઓવીએમ દ્વારા એજીએમમાં ભાગ લઇ શક્શે , પણ તેમને એજીએમમાં ફરીથી મતદાન કરવાની મંજુરી મળશે નહીં .

સભાની નોટિસ મોક્લી આપ્યા પછી કોઈ વ્યક્તિ કંપનીની સભ્ય બની હોય અને તેઓ કટ-ઓફ તારીખ ના દિવસે શેર્સ ધરાવતી હોય તો તેઓએ <u>evoting@nsdl.com</u> ને ઈ-મેઈલ થી વિનંતી કરી યુઝર આઈડી તથા પાસવર્ડ પ્રાપ્ત કરવાના રહેશે. જો કે, એ વ્યક્તિ એનએસડીએલ સમક્ષ ઈ-વોટિંગ માટે અગાઉથી જ નોંધાયેલી હોય તો, તેઓ પોતાના એ જ યુઝર આઈડી તથા પાસવર્ડના ઉપયોગથી પોતાનો મત આપી શકે છે.

ઈ-વોટિંગ સંબંધી કોઈપણ પ્રશ્નો હોય , તો સભ્યો તે માટે <u>evoting@nsdl.com</u> ઉપર હેલ્પ સેક્શનમાં (ફ્રીક્વન્ટલી આસ્ક્ડ કવેશ્વન્સ - "FAQs" (અવારનવાર પુછાતા પ્રશ્નો) અને ઈ-વોટિંગ મેન્યુઅલ નો ઉપયોગ કરી શકે છે અથવા <u>www.evoting@nsdl.com</u> પર ઈ-મેઈલ કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર: ૦૨૨-૪૮૮૬ ૭૦૦૦ અને ૦૨૨-૨૪૯૯ ૭૦૦૦ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે. ઈ-વોટિંગને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો , પ્લવી માતરે, નેશનલ સિક્ચોરીટીઝ ડિપોઝીટરી લિમિટેડ, ટ્રેડ વર્લ્ડ, એ વિંગ, ચોથો માળ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોવર પરેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૧૩નો સંપર્ક ઈ-મેઈલઃ <u>evoting@nsdl.com</u> પર અથવા ઉપરોક્ત ટોલ ફ્રી નંબર ઉપર કરી શકાશે

એજીએમ ને લગતી માહિતી કંપનીની વેબસાઈટ - www.adanigas.com, એનએસડીએલની વેબસાઈટ : www.evoting.nsdl.com તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ વતી,

સ્થળ: અમદાવાદ તારીખ: 30મી મે. ૨૦૨૪

સુરેશ પી. મંગલાની કારોબારી સંચાલક અને મુખ્ય કારોબારી અધિકારી

રજીસ્ટર્ડ ઓફિસ: "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર,

અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. ફોન નં.: +૯૧-૭૯-૨૬૫૬ ૫૫૫૫ | ફેક્સ નં.: +૯૧-૭૯-૨૫૫૫ ૫૫૦૦ વેબસાઈટઃ <u>www.adanigas.com</u> | સીઆઈએનઃ L40100GJ2005PLC046553

BHAGWATI

ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ

(CIN: L27100GJ1981PLC004718)

રજી. ઓફિસઃ સર્વે નંબર ૮૧૬, ગામઃ રજોડા, બાવળા નજીક, અમંદાવાદ-૩૮૨૨૨૦, ગુજરાત, ભારત. ફોનઃ +૯૧ ૨૭૧૪ ૨૩૨૨૮૩/૨૩૨૯૮૩/૨૩૨૦૬૬ E-mail: cs@bhagwati.com Website: www.bhagwati.com કંપનીના ઈક્વિટી શેરનું ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) ઓથોરીટીને હસ્તાંતર

વખતોવખત સુધારવામાં આવ્યા મુજબ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટીગ, ઓડિટ ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ-૨૦૧૬ને વંચાણમાં લેવાની સાથે કંપની ધારા, ૨૦૧૩ (ધી એક્ટ)ની કલમ ૧૨૪(૬)ની જોગવાઈઓ અન્વચે આ નોટીસ આપવામાં આવે છે. નિયમો અનુસાર જેમાં સળંગ સાત કે તેથી વધુ વર્ષોથી ડિવિડન્ડ માટે દાવે કરવામાં આવ્યો નથી શેરધારકોના શેરોનું કંપની દ્વારા ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટીને (રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ પ્રાધિકરણને – આઈઈપીએફ ઓથોરિટીને) ફિઝિકલ સ્વરૂપ કે ડીમટિરિયલાઈઝ્ડ સ્વરૂપમાં હસ્તાંતર કરવું આવશ્યક છે.

રૂલ્સની જોગવાઈઓ અનુસાર શેરધારકો નોંધ લે કે નાણાંકીય વર્ષ ૨૦૧૬–૨૦૧૭ થી આગળ સળંગ સાત વર્ષ માટે ડિવિડન્ડનો દાવો (ક્લેમ) કરવામાં આવ્યો નથી એવા અંતર્ગત (અંડરલાઇંગ) શેરો સાથે નાણાંકીય વર્ષ ૨૦૧૬–૨૦૧૭ માટેનું દાવા કર્યા વગરનું (અનકલેઈમ્ડ) / ભરપાઈ કર્યા વગરનું (અનપેઈડ) ડિવિડન્ડનું હસ્તાંતરણ આઈઈપીએફને કરવામાં આવશે અને રૂલ્સમાં નિર્દિષ્ટ વિવિધ જરૂરિયાતોની પૂર્વતા કરીને કંપની/રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટના રેકોર્ડમાં અધ્યતન સ્વરૂપમાં ઉપલબ્ધ સરનામે સંબંધિત શેર ધારકોને વ્યક્તિગત નોટિસ મોલકવામાં આવી છે. અને તેની સાથે આઈઈપીએફ ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવી રહેલા શેરોની વિગતો પણ પૂરી પાડવામાં આવી છે તેમજ આવા શેરધારકોની યાદી કંપીનીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે અને www.bhagwati.com પર તે જોઈ શકાશે.

જેઓ ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવે છે અને જેમના શેરો આઈઈપીએફ ઓથોરિટીને ટ્રાન્સફર કરવાને પાત્ર છે એવા સંબંધતિ શેર ધારકો નોંધ લેશો કે આઈઈપીએફ ઓથોરિટીને શેર ટ્રાન્સફર કરવાના હેતુસર આ પ્રકારના શેરધારકો દ્વારા ધરાવવામાં આવતા અસલ સર્ટિફિકેટ(સ)ના સ્થાને કંપનીના નવા શેર સર્ટિફિકેટ(સ) ઈસ્યૂ કરાશે અને આ પ્રકારે નવા શેર સર્ટિફિકેટ(સ) ઈસ્યૂ થયે કંપની કોર્પોરેટ કાર્યવાહી દ્વારા નવા શેર સર્ટિફિકેટ(સ)નું ડોમેટ સ્વરૂપમાં રૂપાંતરણ કરવા અને આઈઈપીએફ ઓથોરિટીની તરફેણમાં ટ્રાન્સફર કરવા ડીપોઝિટરીને જણાવશે. શેરધારકોના નામે નોંધાયેલા અસલ શેર સર્ટિફિકેટ(સ) આપો-આપ રદબાદલ કરાશે અને તેને ખરીદી કે વેંચી શકાશે નહીં. જે શેરધારકો ડીમટીરિયલાઈઝડ ફોર્મમાં શેર ધરાવે છે અને જેમનાં શેર આઈઈપીએફ ઓથોરિટીને ટ્રાન્સફર થવા માટે પાત્ર છે તે શેરધારકો નોંધ લેશો કે કંપની આ શેરો આઈઈપીએફ ઓથોરિટીના ડીમેટ એકાઉન્ટની તરફેણમાં ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેટ કાર્યવાહી દ્વારા ડીપોઝિટરીને જણાવશે.

નહીં ચૂકવાયેલ/દાવો નહીં કરવામાં આવેલા ડિવિડન્ડ માટે ક્લેમ (દાવો) કરવા માટે સંબંધિત શેરધારક ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ કે તે પહેલા ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ, સર્વે નં. ૮૧૬, ગામ રજોડા, બાવળા નજીક, જીલ્લો અમદાવાદ – ૩૮૨૨૨૦, ઈ-મેલ: cs@bhagwati.com અથવા કંપનીના આરટીએ એટલે કે મે. એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેડ (યુનિટ ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ), ૧૦૧, શતદલ કોમ્પલેક્ષ, બાટા શો-રૂમ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોન નં. (૦૭૯) ૨૬૫૮૦૪૬૧/૬૨/૬૩, ઈ-મેલ: mcsstaahmd@gmail.comને વિનંતી કરી શકે છે. કંપની રૂલ્સને વળગી રહેવા યોગ્ય તારીખ સુધી આઈઈપીએફ ઓથોરિટીને શેરો ટ્રાન્સફર કરશે. તેના પરિણામે આ પ્રકારના નહીં ચૂકવાયેલ/દાવો નહીં કરાયેલ ડિવિડન્ડ અને અંડરલાઈંગ શેરોના સંદર્ભમાં કંપની વિરૂધ્ધ કોઈ દાવો રહેશે નહીં. સંબંધિત શેરધારકો નોંધ લેશો કે આ પ્રકારે શેરો ટ્રાન્સફર થયા બાદ તેઓ ડિવિડન્ડ સાથે ઉક્ત શેરો અને આ પ્રકારના શેરો પર તમામ લાભો સહિતના દાવા માટે આઈઈપીએફ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી શકશે તે જેની વિગતો

ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ વતી,

निरेन એ. हेसाई કંપની સેક્કેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર



GUJARAT TERCE LABORATORIES LIMITED

Reg. Office:- 122/2, Ravi Estate, Bileshwarpura, Chhatral, Dist. Gandhinagar (Gujarat) Phone:- 079 - 35200400, CIN NO: L24100GJ985PLC007753

email: gtll.factory@gmail.com website:www.gujaratterce.in

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024.

[Rs.In Lakhs except per share detail]

Daviaulaus		Quarter Ende	d	Financial Year Ended		
Particulars	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2023	
Total income from operations	1220.71	1302.02	1288.85	4797.47	4678.25	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional						
and/or Extraordinary items)	84.39	67.28	-41.89	54.39	-289.39	
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional						
and/or Extraordinary items)	84.39	67.28	-41.89	54.39	-289.39	
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional		711.17.28.55	3335		(1000)	
and/or Extraordinary items)	54.34	67.28	80.34	24.34	-167.16	
Total Comprehensive Income for the period [Comprising						
Profit /(Loss) for the period (after tax) and Other						
Comprehensive Income (after tax)]	54.34	67.28	80.34	24.34	-167.16	
Equity Share Capital	742.03	742.03	742.03	742.03	742.03	
Reserves (excluding Revaluation Reserve)	-31.42	-85.76	-55.76	-31.42	-55.76	
Earnings Per Share (of Rs.10/- each)		m/21/22/07/2	12006.1105.55	(2000)	12000000000	
Basic & Diluted:	0.73	0.91	1.08	0.33	-2.25	

Place: Ahmedabad

- 1 The above results have been reviewed by the audit committee of the Company and taken on record by the Board of Directors of the
- Company in its meeting held on 29/05/2024 and same are also been reviewed by the statutory auditors of the Company. 2 The Above Audited Results have been prepared and presented as per Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended ("Ind AS") prescribed under section 133 of the Companies Act, 2013 and in terms of Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations"), as modified by Circular dated August, 10, 2016.
 - The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended on March 31, 2024 filed with the Stock exchanges as per SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The full format of standalone Audited financial results are available on the website of BSE at www.bseindia.com and on company's website www.gujaratterce.in.

By and order of the Board of Director For Gujarat Terce Laboratories Limited

(Managing Director and CEO)

Date: 29.05.2024 Aalap Prajapati DIN: 08088327